



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૭/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૩૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી, ૩૬ વ્યક્તિઓને ઝડપી અને ૨૨૫ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૦૬ કેસ કરી, ૨૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૪,૨૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૩૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૧૩૮/૧૯

સોલા હાઇકોર્ટ: ચેતનાબહેન પરેશભાઈ સામાણી (રહે.આકાશ એલીગન્સ એપાર્ટમેન્ટ સાયન્સ સીટી રોડ સોલા) એ તા.૦૭/૦૭/૧૯ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૦૭/૧૭ થી તા. ૦૭/૦૭/૧૯ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી કાળાભાઈ સાંકાભાઈ પટેલ (રહે.ધનલક્ષ્મી સોસાયટી, માર્કેટયાઈની બાજુમાં, મુ.સરદારપુર, તા.વિજાપુર, જી.મહેસાણા) એ ચેતનાબહેન પાસેથી તેમની મહીન્દ્રા બોલેરો મેક્ષી ટ્રક બી.એસ.-૪ ગાડી નંબર જીજે.૦૧.ઇ.ટી.૫૦૧૪ કિંમત રૂપિયા ૫,૪૦,૮૮૮/- માસીક રૂપિયા ૨૦,૦૦૦/- ના ભાડા પેટે નક્કી કરી ટ્રક લઈ જઈ ભાડુ નહી ચુકવી તેમજ ગાડી પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.એમ.પરમાર ચલાવે છે.

સોલા હાઇકોર્ટ: હસમુખભાઈ હરીભાઈ પટેલ (ઉ.વ.૫૭)(રહે.સુદર્શન ટાવર નિરાતપાર્કની બાજુમાં, અજંતા ઇલોરાની બાજુમાં, થલતેજ) એ તા.૦૭/૦૭/૧૯ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૩/૧૮ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન સોલા સતાધાર ચાર રસ્તા સત્યસુર્યા કોમ્પ્લેક્ષ ખાતે આવેલ પોતાની “શ્રી ભાગ્યલક્ષ્મી ઇલેક્ટ્રોનિક્સ” નામની દુકાનેથી આરોપી મુજાલભાઈ જયદેવભાઈ બારોટ (રહે.સદભાવ એપાર્ટમેન્ટ કેશવબાગ વાડી પાસે નવા વાડજ) તથા તેનો મીત્ર મીનેશભાઈ શાહ (જેના પુરા નામ-સરનામાની ખબર નથી) એ ભેગા મળી જુદી-જુદી કંપનીઓના એ.સી. તથા સેમસંગ કંપનીના એલ.ડી.ટી.વી મળી કુલ કિંમત રૂપિયા ૮૩,૪૩,૫૦૦/- લઈ જઈ તે પેટે બાકી ચૂકવવાના થતા કુલ રૂપિયા ૫૪,૩૩,૫૦૦/- નહી ચૂકવી, હસમુખભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી ડી.એચ.ગઢવી ચલાવે છે.

નરોડા: નાથમણી ધજમણી રાઉત (ઉ.વ.૪૨)(રહે.અસોપાલવ ફ્લેટ નવી પોસ્ટ ઓફીસ પાસે જી.આઇ.ડી.સી. નરોડા) એ અગમ્ય કારણસર તા.૦૭/૦૭/૧૯ સાજના ૬/૦૦ વાગ્યા પહેલા પોતાના ઘરે પંખાના હુકમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી જે.જી.કામળીયા ચલાવે છે.

નિકોલ: અરૂણસિંગ ઓમકારસિંગ પરિહાર (ઉ.વ.૨૫)(રહે.પંચરત્ન એસ્ટેટ ઉવેરી એસ્ટેટની સામે કઠવાડા સિગરવા રોડ નિકોલ) એ અગમ્ય કારણસર તા.૦૬/૦૭/૧૯ રાતના ૧૧/૦૫ વાગ્યા પહેલા શિવમ એક્વાઇલ્ડ-૧ પંચરત્ન એસ્ટેટ ખાતે લોખંડની એંગલમા રસ્સો બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી લક્ષ્મણભાઇ લુંજાભાઇ ચલાવે છે.

રામોલ: પ્રકાશભાઇ ઉર્ફે પીટુ ગિરધરભાઇ મરાઠી (ઉ.વ.૫૦)(રહે.સોમનાથ સોસાયટી, ન્યુ આર.ટી.ઓ.રોડ વસ્ત્રાલ) એ અગમ્ય કારણસર તા.૦૩/૦૭/૧૯ કલાક ૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે પેટ્રોલ છાંટી સળગી જતાં, સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૦૭/૦૭/૧૯ ના કલાક ૭/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી ભીખુભાઇ ભલાભાઇ ચલાવે છે.

દાણીલીમડા: સુજીતકુમાર મુકેશકુમાર દોહરે (ઉ.વ.૨૦) (રહે.રામરહિમનો ટેકરો દાસ્તાન ફેક્ટરી સામે બહેરામપુરા) એ બીમારીથી કંટાળી તા.૦૭/૦૭/૧૯ સાજના ૬/૧૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતની પાઇપ સાથે ઇલેક્ટ્રીક વાયર બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી કાંતીભાઇ મોતીભાઇ ચલાવે છે.

નારોલ: પ્રેમરાજ પીરુરામ સોની (ઉ.વ.૨૧)(રહે.આકૃતી ટાઉનશીપ નંદનવન હાઇટ્સની બાજુમાં નારોલ) એ અગમ્ય કારણસર તા.૦૭/૦૭/૧૯ કલાક ૯/૦૦ વાગ્યા પહેલા પોતાના ઘરે પંખાના હુકમાં યાદર બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી શંકરભાઇ હીરજીભાઇ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.